

Date: 3rd May, 2023

| To, | To, |
|--|----------------------------|
| National Stock Exchange of India Limited | BSE Limited |
| Exchange Plaza, Plot C-1, 'G' Block, | Phiroze Jeejeebhoy Towers, |
| ISB Centre, Bandra-Kurla Complex, | Dalal Street, Fort, |
| Bandra (East), Mumbai-400 051. | Mumbai - 400 001. |
| Company Code No. NKIND | Company Code No. 519494 |

Dear Sir/Madam,

Sub: Regulation 47 of SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015

With reference to the subject referred Regulation, we would like to inform you that Extract of Audited Financial Results for the quarter and year ended 31st March, 2023 as approved in the Board meeting dated 2nd May, 2023 has been published in the Financial Express Newspaper (English) & Financial Express Newspaper (Gujarati) on 3rd May, 2023.

A copy of the said newspaper advertisement is enclosed for your reference and record.

You are requested to take the same on records.

Thanking You.

Yours faithfully, N K INDUSTRIES LIMITED

NIMISH KESHAVLAL PATEL Managing Director, DIN: 00240621

Registered Office: 7th Floor, Popular House, Ashram Road (N.G.)

Ahmedabad - 380 009. India

Ph.: +91-79-6630 9999 Fax: 91-79-26589214

E-Mail:nkil@nkproteins.com

Plant: 745. Kadi-Thor road Kadi - 382 715 Dist. Mehsana

Tele: (02764) 242613, 263884

Fax: (02764) 263667 Email: nkilkadi@yahoo.co.in

CIN NO.: L91110GJ1987PLC009905

zyd®

ZYDUS LIFESCIENCES LIMITED

[CIN L24230GJ1995PLC025878] Regd. Office: Zydus Corporate Park, Scheme No. 63, Survey No. 536, Near Vaishnodevi Circle

Khoraj (Gandhinagar), Sarkhej - Gandhinagar Highway, Ahmedabad - 382481. **Website** : www.zyduslife.com **Email** : dhavalsoni@zyduslife.com **Telephone** : +91-79-48040000

NOTICE

Notice is hereby given that the Company has received intimation from the following shareholder that the Share Certificates pertaining to the Equity Shares held by him as per the details given below have been lost / misplaced.

| Sr. No. | Name of the shareholder | Distinctive Numbers | Folio Number | No. of Shares | Certificate No. |
|------------|--|------------------------|-----------------|------------------|--------------------|
| 1. | Girish P Gangwani Prakash P Gangwani | 1405181-1407430 | 023290 | 2250 | 1225 |

If the Company does not receive any objection within 7 days from the date of publication of this notice, the Company will proceed to issue duplicate Share Certificate to the aforesaid shareholder. People are hereby cautioned not to deal with the above Share Certificates anymore and the Company will not be responsible for any loss / damage occurring thereby.

For, ZYDUS LIFESCIENCES LIMITED Date: May 2, 2023 Sd/- DHAVAL N. SONI Place: Ahmedabad **COMPANY SECRETARY**



રીજનલ ઓફીસ : કોટક મહીન્દ્રા બેંક લી., ૨૨૩-૨૨૯ યક કોમ્પલેક્ષ, શીવરંજની, સેટેલાઇટ, ર Bank - 300094

કબજા નોટીસ

(સિકચરીટી ઈન્ટરેસટ (એન્કોર્સમેન્ટ) નિયમ ૨૦૦૨ ન પરિશિષ્ટ ૪ સાથે રુલ ૮ (૧) વંચાણે લેતા)

કોટક મહીન્દ્રા બેંક લી., ના નીચે સહી કરનાર અધિકૃત અધિકારીએ બેંકીંગ કંપની, બેંકીંગ રેગ્યુલેશન એકટ, ૧૯૪૯ ની વ્યાખ્યામાં જેની રશુંસ્ટર્ડ ઓફીસ : ૨૭બીકેસી, સી ૨૭, જી બ્લોક, બાંદ્રા કુરલા કોમ્પલેક્ષ, બાંદ્રા (પૂર્વ), મુંબઈ – ૪૦૦૦૫૧ અને શાખા ઓફીસ અમદાવાદ સ્થિત સિક્યોરિટાઈઝેશન એન્ડ રીકન્સ્ટ્રક્શન ઓફ ફાયનાન્સિયલ એસેટ્સ એન્ડ એન્ફોર્સમેન્ટ ઓફ સિક્યોરીટી ઈન્ટરેસ્ટ એક્ટ, ૨૦૦૨ તથા કલમ ૧૩(૨) હેઠળ મળેલી સત્તા સાથે સિક્યોરીટી ઈન્ટરેસ્ટ (એન્ફોર્સમેન્ટ) નિયમો ૨૦૦૨, તથા નિયમ ૯ અંતર્ગત વંચાણે લેતાં **તા. ૨૫.૦૮.૨૦૨૦** ના રોજ ઉદ્યારકર્તા **૧. અતુલ ટ્રેડિંગ કં.,** (ઉદ્યારકર્તા), ૨. રવજીભાઈ એમ. સરધરા, ૩. રાજેશભાઈ બી. સરધરા, ૪. વિજયાબેન **આર. સરધરા, ૫. અતુલભાઈ આર. સરધરા** ને નોટીસમાં દર્શાવેલી ૨કમ **રૂા**. ૮૨,૧૩,૯૧૦/- (રૂા. ક્યાંસી લાખ તેર હજાર નવસો દસ ફક્ત) તા. ૧૮.૦૮.૨૦૨૦ ના નોટીસમાં જણાવ્યા મુબજ નોટીસની તારીખથી ૬૦ દિવસોની અંદ૨ ચુકવવા જણાવેલ

ઉપરોક્ત ઉદ્યારકર્તા રકમ ચુકવવામાં કસુરવાર થતાં આથી ખાસ કરીને ઉપર જણાવેલ ઉદ્યારકર્તા અને સામાન્યત: જાહેર જનતાને નોટીસ થી જણાવવામાં આવે છે કે અધિનિયમ १३(४) नी साथे ઉક્ત नियमोना नियम ६ ने वंचाएो लेता अने अधिनियम १४ हेठणना ૨૪.૦૮.૨૦૨૨ના આદેશના અનુસંધાનમાં આપેલી સત્તાની રૂએ તા. ૨૮.૦૪.૨૦૨૩ ના રોજ અધોહસ્તાક્ષરીએ નીચે જણાવ્યા મુજબની મિલકતનો **પ્રત્યક્ષ કબજો** લીધેલ છે.

ઉદ્યારકર્તા ને વિશેષ રૂપથી તથા જહેર જનતાને આથી સદરહુ મિલકત અંગે કોઈપણ જાતને વ્યવહાર ન કરવાની ચેતવણી આપવામાં આવે છે. સદરહું મિલકત અંગે કરેલો કોઈપણ વ્યવહાર કોટક મહીન્દ્રા બેંક લીમીટેડની બાકી રૂા. ૮૨,૧૩,૯૧૦/- (રૂા. બ્યાંસી લાખ તેર **હજાર નવસો દસ કકત) તા. ૧૮.૦૮.૨૦૨૦** ના રોજ ચડત વ્યાજ સાથે કરાર આધારીત દરે રકમ, આનુસાંગીક ખર્ચા, કોસ્ટ, ચાર્જીસ વગેરે તા. ૧૮.૦૮.૨૦૨૦ થી આજ તારીખ સુધી બોજાને આધીન રહેશે.

સંદરહુ કાયદાની કલમ ૧૩ ની પેટા કલમ (૮) ની જોગવાઈ પ્રત્યે ઉદ્યારકર્તાની મુકરર મિલકત છોડાવવા માટે મળવા પાત્ર સમય બાબતે ધ્યાન દોરવામાં આવે છે.

स्थावर भिलङतनी विग<u>त</u>

મિલકત ૧ઃ રહેણાંક મિલકત પ્લોટ નં. ૯ ખાતે સ્થિત, દક્ષિણ બાજુ ગામતળ જમીન એરિયા લેઉવા પટેલ સમાજ સામે, શિવ મંદિર સ્ટ્રીટ સામે, જૂનાગઢ બાયપાસ રોડ, સરગવાડા – જૂનાગઢ, ગુજરાત – ૩૬૨૦૦૧. મિલકત ૨: ૨૯ેણાંક મિલકત પ્લોટ નં. ૧૫/પી ખાતે સ્થિત, દક્ષિણ બાજુ ગામતળ જમીન એરિયા, લેઉવા પટેલ સમાજ સામે, શિવ મંદિર શેરી સામે, જૂનાગઢ બાયા રોડ, સરગવાડા – જૂનાગઢ, ગુજરાત – ૩૬૨૦૦૧

તારીખ : ૨૮.૦૪.૨૦૨૩ ક્થળ : જૂનાગઢ અધિકૃત અધિકારી, કોટક મહીન્દ્રા બેંક લી





GIL invites Expression of Interest (EOI) for colocation service provider on behalf of Department of Science and technology, Government of Gujarat. Interested parties may visit **ttp://www.gil.gujarat.gov.in** for more details about the EOI.

- Managing Director

शाणा- (RACPC)(पूर्व)-१४३५५, भारतीय स्टेट बैंक भोदी आर्डेड जिंडींग, मधीनगर रेब्वे स्टेशन सामे,

भारताय स्टंट बंक भारतायाः अभहावाह-३८००८ State Bank of India मधीनागर, अभहावाह-३८००८ भोन. ०७६-२४४५००६० ४ भेर्यसः sbi.15355@sbi.co.in

બાથી નીચે સહી કરનાર **સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા** ના અધિકૃત અધિકારી સીક્ચોરિટાઇઝેશન એન્ડ રીકન્સ્ટ્રક્શન ઓફ ફાઇનાન્સિયલ એસેટ્સ એન્ડ એન્ફોર્સમેન બોફ સીક્ચોરિટી એક્ટ, ૨૦૦૨ અને તેની સાથેની સત્તાને સેક્શન ૧૩(૧૨) સાથે સીક્ચુરિટી ઇન્ટરેસ્ટ (એન્ફોર્સમેન્ટ) રુલ્સ, ૨૦૦૨ના રુલ -૩ જે તા.૦૧.૦૩.૨૦૨૩ ના રોજ ડીમાન્ડ નોટિસ ઇશ્યૂ કરવામાં આવી છે. તે માટે **શ્રી શેલેન્દ્ર નરેન્દ્ર પરીહાર અને** શ્રીમતી શોભના શેલેન્દ્ર પરીહાર ને નોટિસમા જણાવવામાં આવે છે કે રૂા. ૧૪,૯૬,૬૪૯/-(અંકે રૂપિયા ચૌદ લાખ છજ્ઞું હજાર છસો ઓગણપચાસ પુરા) એ તા. ૦૧.૦૩.૨૦૨૩ થી યાજ અને ચડત વ્યાજ અને ખર્ચ વગેરે સહીત આ નોટિસની રીસિપ્ટની તારીખથી ૬૦ દિવસમાં ચૂકવવાના થાય છે.

ોણદાર રકમ પરત ચૂકવવામાં નિષ્ફળ રહ્યા હોવાથી, દેવાદાર અને સામાન્ય જનતાને અ નોટિસ આપવામાં આવે છે કે કથિત અધિનિયમની સબ કલમ (૪) નિયમ૧૩ તેના નિયમ ૮ સેક્ગોરિટી ઇન્ટરેસ્ટ એન્ફોર્સમેન્ટ રૂલ્સ ૨૦૦૨, સાથે ધ્યાનમાં લીધા બાદ, પોતાને પ્રાપ્ત સત્તાનો ઉપયોગ કરીને, વર્ષ **૨૦૨૩ ના મે ના ૧લા દિવસે,** નીચે સહી કરનારે અહીં વર્ણવેલ મિલ્કતનો સાંકેતિક કબજો મેળવ્યો છે.

આથી ખાસ કરીને દેવાદાર,અને સામાન્ય રીતે જાહેર જનતા અને જાહેર જનતાને જાણ કરવામાં આવે છે કે કોઈપણ જાતનો વ્યવહાર ના કરાવવાની ચેતવણી આપવામાં આવે છે ાંબંધિત મિલકત અંગે કોઇ પણ પ્રકારનો વ્યવહાર કરવામાં આવશે તો તે સ્ટેટ બેંક ઓફ િન્ડિયાના બાકી લેણા **રા. ૧૪,૯૬,૬૪૯/- (અંકે રૂપિયા ચૌદ લાખ છ**ર્સ્નુ **હજાર છસો** ઓગણપચાસ પુરા) એ તા. ૦૧.૦૩.૨૦૨૩ વત્તા વ્યાજ અને અન્ય ખર્ચા.

સરફેસી કાયદાની કલમ ૧૩ની પેટા કલમ ૮ની જોગવાઈ પ્રત્યે દેવાદારોનું મિલકત છોડાવવા માટે મળવા પાત્ર સમય બાબતે ધ્યાન દોરવામાં આવે છે.

स्थावर भिलङतनी विगत :

માલિકીની મિલકતઃ શ્રી શૈલેન્દ્ર એન પરિહાર અને શ્રીમતી શોભના શૈલેન્દ્ર પરિહાર તે તમામ મિલકત ધરાવતો ફ્લેટ નં. બી/૩૦૨ ત્રીજા માળે આશરે ૮૧.૮૪ ચોરસ મીટર (સુપર બિલ્ટ અપ એરિયા) અને લગભગ ૩૦.૩૮ ચોરસ મીટર જાણીતી સ્કીમમાં અવિભાજિત જમીન સાથે. ''આકૃતિ એપાર્ટમેન્ટ'' તરીકે, બિનખેતીની જમીન ધરાવતી રેવન્યુ સર્વે નંબર ૭૨૪/૧,૭૨૪/૨,૭૨૫/૧એ, ૭૨૫/૧બી, ૭૨૫/૨એ અને ૭૨૫/૨બી, ફાઇનલ પ્લોટ નંબર ૧૧૦+૧૧૧/૨ અને ૧૧૦+૧૧૧/૧પી ટાઉન પ્લાનિંગ સ્કીમ નંબર ૧૧૪ નું ૧૧૧/૨, અમદાવાદના રજીસ્ટ્રેશન જીલ્લા અને અમદાવાદ પેટા જીલ્લા-૧૧ અસલાલીમાં, મૌજે રામોલ, તાલુકા વટવા ખાતે આવેલ, આવેલ છે અને છે., પૂર્વ તરફ અથવા તરફઃ ફ્લેટ નંબર બી-૩૦૩ ,પશ્ચિમ તરફ અથવા તરફઃ ૭.૫ મીટર પહોળો રસ્તો, ઉત્તર તરફ અથવા તરફઃ ઇલેક્ટ્રિક સબ સ્ટેશન, દક્ષિણ ારફ અથવા તરફઃ ફલેટ નંબર બી-૩૦૧

તારીખ : ૦૧-૦૫-૨૦૨૩

અધિકૃત અધિકારી ભારતીય સ્ટેટ બેંક



Industries Limited

Work: 745, Kadi-Thor road, Kadi - 382 715 Dist. : Mehsana (North Gujarat) E-mail: nkil@nkproteins.com, Web: www.nkindustriesltd.com

Extracts of Audited Standalone and Consolidated Financial Results for the quarter and year ended on 31st March, 2023 (Rs. In lacs)

| | Stand | alone | Consolidated | | |
|---|--------------------------|--------------------------|--------------------------|--------------------------|--|
| Particulars | Quarter ended 31.03.2023 | Year ended 31.03.2023 | Quarter ended 31.03.2023 | Year ended 31.03.2023 | |
| Total income from opertions (net) | 60.56 | 240.56 | 858.75 | 1,777.47 | |
| Net Profit/(Loss) (before Extraordinary activities after tax) | (6.31) | (161.01) | 38.21 | (186.11) | |
| Net Profit/(Loss) for the period after tax (after Extraordinary items)\ | (6.31) | (161.01) | 38.21 | (186.11) | |
| Equity Share Capital | 600.99 | 600.99 | 600.99 | 600.99 | |
| Earnings Per Share (before extraordinary items) of Rs.10/- each Basic: Diluted: | (0.10) | (2.68) | (0.64) | (3.10) | |
| Earnings Per Share (after extraordinary items) of Rs.10/- each Basic: Diluted: | (0.10) | (2.68) | (0.64) | (3.10) | |

Note:

1. The above is an extract of the detailed format of Audited Financial Results filed with the Stock Exchanges under Regulation 33 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015. The full formats of the Audited Quarterly Financial results are available on the Stock Exchange websites

(URL: http://www.bseindia.com/corporates/ann.aspx?scrip=519494&dur=A&expandable=0)

For and on behalf of Board of Directors N K Industries Limited

Mr. Hasmukhbhai Kacharabhai Patel

Place: Ahmedabad Date: 02/05/2023

Din: 06587284 (Whole Time Director)



PROTECTING INVESTING FINANCE ADVISING

આદિત્ય બિરલા હાઉસીંગ ફાઈનાન્સ લિમિટેડ

રજીસ્ટ્રર્ડ કચેરી : ભારતીય રેયોન કમ્પાઉન્ડ, વેરાવળ, ગુજરાત ૩૬૨૨૬૬. શાખા કચેરીઃ આદિત્ય બિરલા હાઉસીંગ ફાઇનાન્સ લિમિટેડ, ત્રીંજો માળે, ઓફિસ નં. ૨૦૩ થી ૨૧૧, માઇલસ્ટોન ફીંએસ્ટા, ટીજીબી સર્કલ પાસે, એલ.પી. સવાણી રોડ, અડાજણ, સુરત-૩૯૫૦૦૯ ૧. એબીએચએફએલ : અધિકૃત અધિકારી, શ્રી સિધ્ધાર્થ કોટડીયા સંપર્ક નં.+૯૧ ૯૮૨૪૯૦૦૯૯૦, નરેન્દ્ર પટેલ સંપર્ક નં. +૯૧ ૯૯૦૯૯૬૭૩૨૩ અને ચિરાગ લોખંડે સંપર્ક નં. +૯૧ ૯૭૦૩૭૫૮૨૦૮ ર. હરાજી સર્વિસ કર્તા (એએસપી) મેસર્સે ગ્લોબ ટેક ઇનફોસીસ્ટમ્સ પ્રાઇવેટ લિમિટેડ- શ્રી સમીર ચકવર્તી, સંપર્ક નં. +૯૧ ૧૮૧૦૦૨૯૬૩૩, +૯૧ ૧૨૪૪૪૦૮૫૫, ઇ-મેઇલ આઇડી : CARE@BestAuctionDeal.com

स्थावर भिલક्तोना वेचाए माटे वेचाए नोटीस સિક્યોરિટી ઇન્ટરેસ્ટ (એન્ફોર્સમેન્ટ) નિયમો, ૨૦૦૨ ના નિયમ ૮(૬) ની જોગવાઇઓ સાથે વંચાતા સિક્યોરિટાઇઝેશન અને રિકન્ટ્રક્શન ઓફ ફાયનાન્સિયલ એસેટ્સ અને એન્ફોર્સમેન્ટ ઓફ સિક્ચોરિટી ઇન્ટરેસ્ટ એક્ટ, ૨૦૦૨ હેઠળ સ્થાવર મિલકતોના વેચાણ માટે ઈ-હરાજી વેચાણ નોટીસ.

આદિત્ય બિરલા હાઉસિંગ ફાઇનાન્સ લિમિટેડના અધિકૃત અધિકારી/સુરક્ષિત દેણદારે ફાઇનાન્શિયલના સિક્ચોરિટાઇઝેશન અને રિકન્સ્ટ્રક્શનની કલમ ૧૩(૨) હેઠળ મળેલ મોકલેલ નોટિસના અનુસંધાનમાં નીચેની સુરક્ષિત મિલ્કતનો કબજો લીધો હતો.સિક્ચોર્ડ દેણદારના સુરક્ષિત ઋણની વસૂલાત માટે અસ્કયામતો અને અમલીકરણ અધિનિયમ, ૨૦૦૨ (સરફેસી) નીચે આપેલા ઋણ લેનારાઓ અને કંપની પાસેથી વધુ શુલ્ક અને તેના ખર્ચ સાથે નીચે ઉલ્લેખિત બાકી લેણાં માટે લેનારાઓ. આથી જાહેર જનતાને સામાન્ય રીતે અને ખાસ કરીને ઋણ લેનારાઓ અને કંપની ઋણ લેનારાઓને સૂચના આપવામાં આવે છે કે આદિત્ય બિરલા હાઉસિંગ ફાયનાન્સ લિમિટેડના દેવાની વસૂલાત માટે નીચેની મિલકતની ઈ-હરાજી ''જ્યાં છે તે છે'' અને ''જેમ છે તે પ્રમાણે'' આધારે કરવામાં આવશે.

| ક્રમ નં. | દેવાદારો અને સહ દેવાદારોનું નામ | મિલકતો/સુરક્ષિત એસેટ્સનું વર્ણન | ડીમાન્ડ નોટીસ મુજબ રકમ | રિઝર્વ કિંમત | ઈએમડી | ઈએમડીની છેલ્લી તારીખ | નીરીક્ષણની તારીખ અને સમય | ઈ-હરાજીની તારીખ |
|-------------|--|---|---|---|--|-------------------------|--|--------------------|
| વ | લીલારામ વિરમરામ દેવાસી, ઝુમા દેવી | તે તમામ ભાગ અને હિસ્સા પ્લોટ નં. દ૯, આરાધના પ્લેટીનમ વિભાગ-ર, આર.એસ. નં. ૪૭૧, બ્લોક નં. ૪૬૩, પેપર મીલ સામે, , ગંગાધરા રેલ્વે સ્ટેસન, ઉમરખ, બારડોલી, સુરત-૩૯૪૩૧૫, સુરત ગુજરાત ભારત-૩૯૪૬૦૧. | ૧૭,૩૧,૪૯૫.૪૨/- (રૂપિયા સત્તર લાખ એકત્રીસ હજાર ચારસો પંચાધું અને બેતાલીસ પૈસા પુરા) તા. ૨૧-૧૧-૨૦૨૧ | ૧૩,૦૦,૦૦૦/- (રૂપિયા તેર લાખ પુરા) | ૧,૩૦,૦૦૦/- (રૂપિયા એક લાખ ત્રીસ હજાર પુરા) | ૧૯-૦૫-૨૦૨૩ | ૧૭-૦૫-૨૦૨૩ સવારે ૧૧ થી ૪ વાગ્યા સુધી | ₹0.04.₹0₹3 |
| સ્ | નિલેશકુમાર છગનભાઈ પટેલ, સુચીત બાલકૃષ્ણ કોલામ્બે, અરૂણ શ્રવણ નરખેડે | તે તમામ ભાગ અને હિસ્સા બાંધકામ સાથે બ્લોક નં. ૧૦૦, સબ ડીવીઝન નં. ૧, બ્લોક નં. ૧૨મા માળે, ફલેટ નં. ૧૨૦૧, મોજે વનાકલા, આર.એસ. નં. ૮૬/૧, ૮૬/૩, વૈષ્ણવદેવી સ્કાય, ટાઈપ-ડી, બિલ્ડીંગ નં. ૧, વૈષ્ણવદેવી બ્લ્યુની પાછળ, જહાંગીરબાદ, સુરત ગુજરાત ભારત-૩૯પ૦૦પ | ૪૩૨૫૦૯૯.૩૩/- (રૂપિયા તેંતાલીસ લાખ પચીસ હજાર નવ્વાણું અને તેંત્રીસ પૈસા પુરા) તા.૧૪-૦૭-૨૦૨૧ | ૩૦,૩૬,૦૦૦/- (રૂપિયા ત્રીસ લાખ છત્રીસ હજાર પુરા) | ૩,૦૩,૬૦૦/- (રૂપિયા ત્રણ લાખ ત્રણ હજાર છસો પુરા) | | ૧૭-૦૫-૨૦૨૩ સવારે ૧૧ થી ૪ વાગ્યા સુધી | ₹0.04.₹0₹3 |

વેચાણના વિગતવાર નિયમો અને શરતો માટે, કૃપા કરીને આદિત્ય બિરલા હાઉસિંગ ફાઇનાન્સ લિમિટેડ/સિક્ચોર્ડ ક્રેડિટરની વેબસાઇટમાં આપેલી લિંકનો સંદર્ભ લો એટલે કે

.https://homefinance.adityabirlacapital.com/properties-for-auction-under-sarfaesi-act અથવા https://sarfaesi.auctiontiger.net તારીખ : ૦૩-૦૫-૨૦૨૩ ભાષાંતરમાં તૃટી અથવા વિસંગતતા હશે તો અંગ્રેજી સંસ્કરણ માન્ય રહેશે.

સ્થળ : સુરત

અધિકૃત અધિકારી આદિત્ય બિરલા હાઉસીંગ ફાયનાન્સ લીમીટેડ



पंजाब नैश्ननल बैंक 🖳 punjabnational bank

ઝોનલ સસ્ત્ર, અમદાવાદ, યોથો માળ, ચાણક્ય બિલ્ડીંગ, દિનેશ હોલ પાસે, આશ્રમ રોડ, અમદાવાદ, ગુજરાત. ફોનઃ 07947010262, Email:zs8336@pnb.co.in

અચલિત મિલકતોનાં વેચાણ માટે વેચાણ નોટીસ

ધી સિક્યોરિટાઇગેશન એન્ડ રિકન્સ્ટ્રક્શન ઓફ ફાયનાન્શિયલ એસેટ્સ એન્ડ એન્ફોર્સમેન્ટ ઓફ સિક્યોરિટી ઇન્ટરેસ્ટ એક્ટ, ૨૦૦૨ને સિક્યોરિટી ઇન્ટરેસ્ટ (એન્ફોર્સમેન્ટ) નિયમો, ૨૦૦૨ના <mark>નિયમ ૮(૬)ની જેગવાઇ સાથે વેચાણે લેતાં સ્થાવર સંપત્તિના ઇ-હરાજી વેચાણ નોટિસ</mark> જાહેર જનતાને સામાન્થ રીતે અને વિશેષ રીતે દેણદાર(૨) તેમ જ જામીનદાર(૨))ને અત્રે નોટિસ આપવામ આવે છે કે નીચે આપેલ સ્થાવર સંપત્તિ કે જે સિક્ચોર્ડ લેણદારને ગિરવે રાખેલ/ ચાર્જ કરેલ છે અને પંજાબ નેશનલ બેંક (સિક્ચોર્ડ લેણદાર)ના અધિકૃત અધિકારી દ્વારા **કન્સ્ટ્રકરીવ / પ્રત્યક્ષ /** સાંકેતિક કબજો લેવામાં આવ્યો છે, **તે જેમ છે જયાં છે અને જે છે તે છે ના આધારે** પંજાબ નેશનલ બેંકે નીચે ઉલ્લેખ કરેલ દેણદાર(રો) ગીરોદાર(રો) તેમ જ જામીનદાર(રો) પાસે લેવાની રકમની વસૂલાત માટે વેચવામાં આવશે. રિઝર્વ કિંમત અને ઈએમડી સંબંધિત મિલક્ત સામેના ખાતામાં જમા કરવાની રહેશે.

સુરક્ષિત અસ્કથામતોનું શિડ્યુલ

| ٤ | ઈ-હરાજીની તારીખ : ૦૮.૦૬.૨૦૨૩, ઈએમડી જમા કરાવવાની છેક્ષી તારીખ અને સમય ઃ ૦७.૦૬.૨૦૨૩ સાંજે ૫.૦૦ વાગ્યા સુધી | | | | | | |
|--------|--|--|--|---|--|--|--|
| о о | શાખાનું નામ એકાઉન્ટનું નામ કરજદાર/જામીનદારો નું એકાઉન્ટ નામ અને સરનામું | અચલિત મિલકતો / ગીરો સિક્ચોરીટી ની વિગતો / માલીકોના નામ (ગીરો મિલકતો) | (e) સરફેસી એક્ટ ૨૦૦૨ ના ૧૩(૨) અંતર્ગત કિમાન્ટ નોટીસ તારીખ (l.1) ૧૩/૨ ની નોટિસ મુજબ બાકી રકમ (f.2) આપેત તારીખ મુજબ બાકી રકમ (g) સરફેસી એક્ટ ૨૦૦૨ નાસેકશન ૧૩(૪) અંતર્ગત કબ્જા તારીખ (h) કબજાનો પ્રકાર - સોકેતિક / પ્રત્યુસ /કન્ટર્ટ્ટરીય (j) ૧૩(૨) નોટીસ ઇસ્યુ કર્યા બાદ રીકપર કરેલ રકમ (૨૭.૦૪.૨૦૨૩ સુધી) | (a) રીઝર્વ કિંમત (b) ઈએમડી (c) બીડ વધારવાની રકમ | ઈ-હરાજી ની તારીખ / સમય | | |
| 1. | L.C.B. અમદાવાદ, શ્રૈભિક લિમિટેક; શ્રૈભિકભાઈ સુધિરભાઈ વીમાવાલા (પ્રમોટર / જામીનદાર) એ/૨, રીવીરા એન્ટાલીચા, સુચોગ બંગલો સામે, કોર્પોરેટ રોક, પ્રહલાદનગર, અમદાવાદ - ૩૮૦૦૫૧. | ગોડાઉન નં. રક, ધ અનાજ બજાર કો. ઓપ શોપસ એન્ડ વેરફાઉસ સોસાચટી લિમિટેડ, ટીપી સ્કીમ નં. હ, ફાઈનલ પ્લોટ નં. ૪ક, સાથે ત્યાં થયેલ બાંધકામ સાથે રોડના ઉપયોગનો હક, કોમન પ્લોટ અને ખૂલી જગ્યા અને સ્કીમની કોમન સુવિધાઓ મોજે (સીમ) ખોખરા - મહેમદાવાદ, તાલુકા મણીનગર, જીલો: અમદાવાદ, સબ જીલો અમદાવાદ - ૫ (નારોલ) ૧૭૫.૫૮ સ્કે. મીટર્સ. ચતુરસીમા આ મુજબ છે: પૂર્વ: સોસાચટી રોડ, પશ્ચિમ: સોસાચટી રોડ, ઉત્તર: ગોડાઉન નં. ૨૯, દક્ષિણ: ગોડાઉન નં. ૨૫, મિલકતના માલિક: શ્રૈણિક લિમેટેડ (અગાઉ શ્રૈણિક ટ્રેડલિંક પ્રા. લિ. તરીકે ઓળખાતું હતું) | (f.1) Rs.118,47,04,971.85 + ચ ริส | (a) Rs.3,20,00,000.00 (b)Rs.32,00,000.00 (c.)Rs.1,00,000.00 | તારીખ: 08.06.2023 સમચ: 11:00 am to 1:00 pm | | |

SBI: Rs.4,10,27,873.42).

સિક્યોર્ડ ક્રેડિટરની જાણમાં હોય તેવા બોજાની વિગતો - જાણમાં નથી

. ઈ-હરાજીના નિયમો અને શરતો : વેચાણ ધી સિક્ચોરિટી ઈન્ટરેસ્ટ (એન્ફોર્સમેન્ટ) નિયમો ૨૦૦૨માં આપેલ શરતો અને નિયમો અને નીયેની વધુ શરતોને આધીન રહીને થશે. ૧. હરાજીથી વેચાણ પોર્ટલ http://www.mstcecommerce.com/ પર 'ઈ-હરાજીથી ઓનલાઇન'થી કરવામાં આવશે. ૨. ઈચ્છુક બીડરો /ખરીદદારોને પોર્ટલ પર પોતાના મોબાઈલ નંબર અને ઈ-મેઇલ આઇડીનો ઉપયોગ કરીને નામ રજિસ્ટર કરવા વિનતી છે. વધુમાં, તેમને જરૂરી કેવાયસી દસ્તાવેજો અપલોડ કરવા વિનતી છે. ઈ-હરાજી સર્વિસ પ્રોવાઇડર દ્વારા એક વાર કેવાયસી દસ્તાવેજોની ચકાસણી થઈ જાય (બે કામકાજી દિવસ લાગે) કે ઈચ્છુક બીડરો /ખરીદદારોએ ઈ-હરાજીની તારીખ અને સમય અગાઉ ઓનલાઇન મોડથી તા. ૦૭.૦૬.૨૦૨૩ સુધી પોતાના ગ્લોબલ ઈએમડી વોલેટમાં ઈએમડીની રકમ ટ્રાન્સકર કરાવવાની રહેશે. કેવાયસી દસ્તાવેજોના રજિસ્ટ્રેશન, ચકાસણી અને ઈએમડી જમા કરાવવાનું હરાજી પોર્ટલ પર પહેલાવહેલી તકે પૂરું કરવાનું રહેશે. ૩. ઉપર જણાવ્યા મુજબની અનેંસ્ટ મની ડિપોઝીટ (ઈએમડી)ની રકમ (https:www.mstcecommerce.com) થી ચલણ બનાવીને ઓનલાઇન ૩ મોડ એટલે કે નેફટ / રોકડા/ ટ્રાન્સફર ફ્રારા બીડર ગ્લોબલ ઈએમડી વૉલેટમાં જમા કરાવવાના રહેશે. નેફ્ટ ટ્રાન્સફર કોઈ પણ શેડચૂલ્ડ કૉમર્શિયલ બેંક મારફતે થઈ શકશે પણ રોકડા/ ટ્રાન્સફર માટે પંજાબ નેશનલ બેંકની શાખામાં જેવાનું રહેશે. ઈએમડી ચેક જેવી બીજી રીતથી સ્વીકારવામાં આવશે નહીં. જે બીડરો ઈએમડી ઓનલાઇન જમા નહીં કરાવી શકે તેઓને ઈ-હરાજીમાં ભાગ લેવાની પરવાનગી નહીં મળે. અર્નેસ્ટ મની ડિપોઝીટ પર કોઈ વ્યાજ નહીં મળે. ૪. ઈ-હરાજી માટે પ્લેટકોર્મ (https:www.mstcecommerce.com) ઈ-હરાજી સર્વિસ પ્રોવાઈડર મે. એમએસટીસી લિમિટેડ. રજિ. ઓફિસ ૨૨૫-સી, એ.જે.સી. બોઝ રોડ, કોલકાતા- ૭૦૦૦૨૦ (સંપર્ક ફોન અને ટોલ ફ્રી નંબર ૦૭૯-૪૧૦૭૨૪૧૨/૪૧૧/૪૧૩ અથવા૧૮૦૦-૧૦૩ પ ૩૪૨) છે. ઈચ્છુક બીડરો /ખરીદદારોએ ઈ-હરાજી સર્વિસ પ્રોવાઈડરની વેબસાઇટ https:www.mstcecommerce.com પર ઈ-હરાજી પ્રક્રિયામાં ભાગ લેવાનો છે. આ સર્વિસ પ્રોવાઈડર પોર્ટલ પર ઈ-હરાજી પર ઓનલાઇન ડેમોન્સ્ટ્રેશન/ તાલીમની જોગવાઈ પૂરી પાડશે. પ. વેચાણ નોટિસમાં આપેલ વેચાણના સામાન્ય શરતો અને નિયમો નીચેની વેબસાઇટ /વેબ પેજ પોર્ટલ પર ઉપલબ્ધ /પ્રકાશિત થયેલ છે : (1) https://www.ibapi.in, (2) http://www.mstcecommerce.com, (3) www.pnbindia.in ૬. ઈ-હરાજીમાં ભાગ લેવા ઇચ્છુકો આ હરાજી સાથે સંબધિત વેચાથ નોટિસ, ઈ-હરાજીના નિયમો અને શરતો, ઈ-હરાજીના ઓપરેશનલ હિસ્સા પર હેલ્પ મેન્યુઅલી ૯-Βक્રय–IBAPI portal **(https://www.ibapi.in)** પોર્ટલ પરથી નિ:શુહ્ક ડાઉનલોડ કરી શકે છે. ૭. ઈચ્છુક બીડરો /ખરીદદારોને પોર્ટલ (https:www.mstcauction.com) પર પોતાના મોબાઈલ નંબર અને ઈ-મેઇલ આઇડીનો ઉપયોગ કરીને નામ રજિસ્ટર કરવા વિનંતી છે. વધુમાં, તેમને જરૂરી કેવાયસી દસ્તાવેજો અપલોડ કરવા વિનંતી છે. ઈ-હરાજી સર્વિસ પ્રોવાઇડર દ્વારા એક વાર કેવાયસી દસ્તાવેજોની ચકાસણી થઈ જાય (૨ કામકાજી દિવસ લાગે) કે ઈચ્છુક બીડરો /ખરીદદારોએ ઈ-હરાજીની તારીખ અને સમય અગાઉ ઓનલાઇન મોડથી પોતાના ગ્લોબલ ઈએમડી વૉલેટમાં ઈએમડીની રકમટ્રાન્સફર કરાવવાની રહેશે. વૉલેટમાં પૂરતી ઈએમડી જમા હશે તો જ રસ ધરાવતા બીડર હરાજીની તારીખે બીડ કરી શકશે. ૮. બીડિંગ સમયે બીડરના ગ્લોબલ વૉલેટમાં પૂરતું બેલેન્સ (I=ઈએમડીની રકમ) હોય તે જરૂરી છે. ૯. ઈ-હરાજી દરમિયાન બીડરોને ઈન્ટ્રર-સે બીડિંગમાં છેલ્લે ક્વોટ થયેલ બીડ ફરતા વધારે ઊંચું બીડ બોલવાની છૂટ રહેશે અને બીડની રકમમાં બીડરના ર્ડલામાં છેલ્લા ઊંચા બીડ કરતાં ઓછામાં ઓછો ઉપર જણાવેલ ૨કમ થી વધારો થઈ શકશે. બીડરોને સક્સેસિવ હાયર બીડ લગાવવા માટે ૧૦ મિનિટનો સમય આપવામાં આવશે અને જો કોઈ બીડર તરફથી હાયર બીડ આવશે નહીં તો છેલ્લા હાઇએસ્ટ બીડ પછીની ૧૦ મિનિટ પત્યા પછી ઈ-હરાજી પૂરી કરવામાં આવશે. ૧૦. ઈચ્છુક બીડર(રો)ની એ જવાબદારી રહેશે કે હરાજી સાથે સંબંધિત વેચાણ નોટિસ, ઈ-હરાજીના નિયમો અને શરતો, ઈ-હરાજીના ઓપરેશનલ હિસ્સા પર હેલ્પ મેન્યુઅલ વગેરે સારી રીતે વાંચે અને તે અનુસાર પાલન કરે. (૧) ઈ-હરાજી અગાઉ કે તે દરમિયાન કોઈ તકલીક પડે કે સહાયની જરૂર હોય તો ઈ-હરાજી સર્વિસ પ્રોવાઇડરના અધિકૃત અધિકારીનો સંપર્ક કરે જેની વિગતો ઈ-હરાજી પોર્ટલ (http://www.mstcecommerce.com/ પર આપેલી છે. ૧૧. અધિકૃત અધિકારી દ્વારા ઈ-હરાજી પૂરી થયેથી, માત્ર સફળ બીડરને અમારા ઉપરોક્ત સર્વિસ પ્રોવાઇડર દ્વારા એસએમએસ/ઈમેઇલ દ્વારા જાણ કરવામાં આવશે. (તેમણે આપેલા / સર્વિસ પ્રોવાઇડર પાસે રજિસ્ટર થયેલ આ મોબાઇલ નં. / ઈમેઇલ એડ્રેસ પર) ૧૨. રિઝર્વ કિંમતથી આછી કિંમતે સિક્યોર્ડ એસેટ વેચાશે નહીં. ૧૩. સફળ બીડરે બીડની ૨૫% રકમ (પચીસ ટકા) ઈએમડી બાદ કરીને એ જ દિવસે અથવા તરતના કામકાજી દિવસથી મોડું નહીં તેમજમા ૧૨.૧૯ઝા કમાત્રા આછી કમતા હતું હતું ત્યાર હતું કરાય કરવાય કરવાય કરવાય કરતા મુખ્ય કરતા મહત્વ હતું હતું હતું હતું કરાવવાની રહેશે અને બાકીની ૭૫% રકમહરાજીની તારીખથી દિન૧પમાં શૈજ્યલ કોમશિયલ બેંકમાંથી આધિકૃત અધિકારી, પજાબ નેશનલ બેંક એકા. (ખાતાનું નામ)ની તરફેણમાં બેંકસે ચેક/ડિમાન્ડ પ્રફ્રેટ કઢાવીને ભરી દેવી. આપેલ સમયમાં રકમજમા કરવામાં કસૂર થયેથી સફળ બીડર ક્રારા જમા કરાયેલ રકમબેંક જત્ત કરી લેશે અને અધિકારીને નવેસરથી મિલકતની હરાજ / વેચાણ યોજવાની છૂટ રહેશે અને કસૂરવાર ખરીદદારનો જપ્ત કરેલ રકમકે મિલકત પર કોઈ દાવો ચાલશે નહી. ૧૪. સફળ બીડર દ્વારા વેચાણ કિંમતની ચૂકવણી બેંકને આવકવેરા ધારા ૧૯૬૧ના સેકશન્ ૧૯૪-૧એ મુજબ થશે અને સફળ બીડરે બીડેની રકમની બાકીની ૭૫ %રકમ/બીડની પૂરેપૂરી રકમજમા કરાવતી વખતે જ ટીડીએસ કરાવવાનો રહેશે. ૧૫. અધિકૃત અધિકારી કોઈ પણ કારણ આપ્યા વગર, કોઈ પણ ઓફર સ્વીકારવાનો કે જો અસ્વીકાર્ય લાગે તો તમામ ઓકરોને નકારવાનો કે પાછુ ઠેલવાનો /રદ કરવાનો અંડજર્ન /બંધ રાપાવાનો કે હરાજની શરતોમાં કોઈ પણ સમયે ફેરફાર કરવાનો બધિકાર સુરક્ષિત રાખે છે અને આ અંગે એમનો નિર્ણય આખી ગણાશે. ૧૬. આખીય વેચાણ કિંમત ચૂકવા પછી કાયદાની જોગવાઈ મુજબ સફળ બીડરની તરફેણમાં એક વેચાણ સર્ટિફિકેટ આપવામાં આવશે. ૧૭. મિલકતોનું 'જેમછે જ્યાં છે' 'જે છે તે છે' અને 'જે કોઈ ત્યાં છે' ના આધારે વેચાણ થશે. ૧૮. સૂચિમાં આપેલ સિક્યોર્ડ અસ્ક્યામતોની માહિતી અધિકૃત અધિકારીની શ્રેષ્ઠતમજાણકારી મુજબ દર્શાવેલ છે. છતાં અધિકૃત અધિકારી આ જાહેરાતમાં કોઈ ભૂલ, ગેરનિવેદન કે બાકી રહી જતું હોય તો જવાબદાર રહેશે નહીં. ૧૯. બીડરની એ જવાબદારી રહેશે કે બીડ જમા કરાવતા અગાઉ મિલકત અને તેના સ્પેસિફિકેશનો અંગે નિરીક્ષણ કરીને ખાત્રી કરી લે. બીડર આપેલ વિગતો મુજબ સંબંધિત અધિકારીની સલાહ લઈને મિલકતનું નિરીક્ષણ કરે. ૨૦. તમામ સ્ટેચ્યુટરી એટેન્ડન્ટ ચાર્જેસ અન્ય તમામ ડ્યૂઝ જેમકે રજિસ્ટ્રેશન ચાર્જેસ, સ્ટેમ્પ ડ્યૂટી, વેરા વગેરે ખરીદદારે ચૂકવવાના રહેશે. ૨૧. અધિકૃત અધિકારી કે બેંક ઈ-હરાજીમાં મૂકાયેલ મિલકતના સંદર્ભમાં કોઈ ચાર્જ, લિયન, કરભારણ કે સરકારી અથવા બીજા કોઈના અન્ય લેણા વિશે જવાબદાર રહેશે નહીં. ઈચ્છુક બીડરને સલાહ છે કે મિલકત પરના સ્ટેચ્યુટરી લાયેબિલિટીઝ, મિલકતવેરો કે વીજળી બિલ ચૂકવવાના બાકી હોય વગેરે સહિતના કરભારણ વિશે પોતાની રીતે સ્વતંત્ર રીતે તપાસ કરાવી લે. ૨૨. બીડરે યોગ્ય ઈન્ટરનેટ કનેક્ટિવિટી, પાવર બેક અપ વગેરેની ખાત્રી કરી લેવી. બેંક ઈન્ટરનેટ ફેલ્યર, પાવર ફેલ્યર કે ટેકનિકલ કારણોસર કે કંટિજન્સીસને લીધે ઈન્હરાજીને કોઈ પણ પ્રકારની દખલ થાય તે માટે જવાબદાર રહેશે નહીં. ૨૩. બેંક પોતાનો પ્રતિનિધિ નીમીને જાતે બીડ કરે અને હરાજીમાં ભાગ લઈ શકે છે. વેચાલના નિયમો અને શરતોની વિગતો માટે https://www.ibapi.in, http://www.mstcecommerce.com/ & www.pnbindia.in પર

તારીખ : ૦૧.૦૫.૨૦૨૩ સ્થળઃ અમદાવાદ

STATUTORY SALE NOTICE UNDER RULE 8(6) OF THE SARFAESI ACT, 2002

અભિનવ સિંહ રાઠોડ, અધિકૃત અધિકારી પંજાબ નેશનલ બેંક, સિક્ચોર્ડ ક્રેડિટર, (M-97292 25088)

અંગ્રેજી અને ગુજરાતી જાહેરાતમાં તફાવતની સ્થિતિમાં કાયદાકીય બાબતો માટે અંગ્રેજીમાં પ્રકાશિત થયેલ નોટીસ માન્ય ગણાશે



Newgen Software crosses Rs 1,000 cr milestone YoY Revenue growth of 32% for the guarter and 25% for the full year

Revenues 1.008 Cr 25% YoY growth Subscription Revenues **323** Cr 31% YoY growth

Profit after Tax 176 Cr 18% PAT Margin

Extract of Consolidated Financial Results for the Quarter and Year ended March 31, 2023

| | | Consolidated (Amount in Rupees Lakhs) | | | | | |
|------------|--|---|---|-------------------------------|-------------------------------|--|--|
| | | Quarte | Quarter Ended | | Year ended | | |
| SI. No. | Particulars | 31 March 2023 (Audited) (Refer note 2) | 31 March 2022 (Audited) (Refer note 2) | 31 March 2023 (Audited) | 31 March 2022 (Audited) | | |
| 1. | Total Income from Operations | 30,505.01 | 23,142.03 | 97,397.88 | 77,896.15 | | |
| 2. | Net Profit / (Loss) for the period (before Tax, Exceptional and/or Extraordinary items) | 9,635.71 | 6,607.81 | 21,728.05 | 20,345.36 | | |
| 3. | Net Profit / (Loss) for the period before tax (after Exceptional and/or Extraordinary items) | 9,635.71 | 6,607.81 | 21,728.05 | 20,345.36 | | |
| 4. | Net Profit / (Loss) for the period after tax (after Exceptional and/or Extraordinary items) | 7,861.22 | 5,740.70 | 17,626.53 | 16,421.47 | | |
| 5. | Total Comprehensive Income for the period [Comprising Profit / (Loss) for the period (after tax) and Other Comprehensive Income (after tax)] | 8,106.46 | 5,616.14 | 18,147.40 | 16,349.34 | | |
| 6. | Paid up Equity Share Capital (Face Value of Rs. 10 each) | 6,965.57 | 6,954.02 | 6,965.57 | 6,954.02 | | |
| 7. | Reserves (excluding Revaluation Reserve) as shown in the Audited Balance Sheet of the previous year | 90,710.56 | 74,186.09 | 90,710.56 | 74,186.09 | | |
| 8. | Earnings Per Share (of Rs. 10/- each) (for continuing and discontinued operations) - 1. Basic EPS: 2. Diluted EPS: | 11.29 | 8.25 | 25.32 | 23.65 | | |
| 1 | Z. Diluted EPS: | 11.04 | 8.22 | 25.00 | 23.5 | | |

NOTE:

The above financial results for the quarter and year ended 31 March 2023 were reviewed by the Audit Committee in it's meeting held on 1 May 2023 and approved by the Board of Directors in it's meeting held on 2 May 2023. Standalone and Consolidated financial results of the Company for the quarter and year ended 31 March 2023 are prepared in accordance with Indian Accounting Standards (Ind AS) prescribed under Section 133 of the Companies Act, 2013 and relevant rules thereunder.

The auditors have carried out audit of Standalone and Consolidated results of the Company for the year ended 31 March 2023. There are no qualifications in the Auditor's report on these financial results. The figures for the quarter ended 31 March 2023 and 31 March 2022 are the balancing figures between the audited figures for full financial year and the unaudited figures upto the nine months ended 31 December 2022 and 31 December 2021, respectively, which were subjected to limited review by the statutory auditors.

| ney standardne i mandar imorriación | | | (Amo | ount in Rupees Lakns | |
|-------------------------------------|---|---|-------------------------------|-------------------------------|--|
| | Quarte | r Ended | Year ended | | |
| Particulars | 31 March 2023 (Audited) (Refer note 2) | 31 March 2022 (Audited) (Refer note 2) | 31 March 2023 (Audited) | 31 March 2022 (Audited) | |
| Revenue from operations | 28,344.38 | 21,057.15 | 88,780.06 | 71,078.57 | |
| Profit before tax | 9,220.20 | 6,399.06 | 20,717.17 | 19,255.13 | |
| Profit after tax | 7,638.05 | 5,613.67 | 16,989.36 | 15,599.25 | |
| | | | | | |

- During the year, the Nomination & Remuneration Committee has granted 35,000 RSUs on 18th October 2022 to its employees under Newgen Restricted Stock Unit Scheme 2021. The Committee has also granted 9,41,800 and 20,000 options to its employees under Newgen ESOP Scheme 2022 and Newgen ESOP Scheme 2014 res
- The Board of Directors in their meeting held on 2 May 2023 recommended a dividend of INR 5/- (five) per equity share for the financial year ended 31 March 2023. The ment is subject to approval of shareholders at the ensuing Annual General Meeting
- A Scheme of Amalgamation u/s 230-232 of the Companies Act, 2013 which provides for the merger of Number Theory Software Private Limited (NTSPL), a wholly owned subsidiary with the Company, has been approved by the Shareholders and unsecured creditors of the Company in their respective meetings convened by NCLT on 24 September 2022, subject to requisite approval(s). The second motion application has been filed and is pending with NCLT.
- Previous period's figures have been regrouped/reclassified wherever necessary to correspond with the current period's classification/disclosure
- The above is an extract of the detailed format of financial results for the quarter and year ended 31 March 2023 filed with the Stock Exchanges under Regulation 33 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015. The full format of the financial results for the quarter and year ended 31 March 2023 are available on the websites of the Stock Exchanges of BSE and NSE at www.bseindia.com and www.nseindia.com respectively and also available under the Investor Relations section of our website www.newgensoft.com.

NEWGEN SOFTWARE TECHNOLOGIES LIMITED CIN: L72200DL1992PLC049074

Registered Office: E-44/13, Okhla Phase 2, New Delhi-110020 Tel: (+91)-11-40770100, 46533200, 26963571, Fax: (+91)-11-26856936

Email:/ URL: investors@newgensoft.com/ https://newgensoft.com/ Date: 02.05.2023

For and on behalf of the Board Diwakar Nigam **FINANCIAL EXPRESS**

BharatPe buys 51% in Trillion Loans

FE BUREAU Mumbai, May 2

BHARATPE GROUP HAS acquired a majority stake in Mumbai-based non-banking financial company Trillion Loans. The deal was completed in April. The acquisition is in line with the group's vision to be at the forefront of addressing the credit gap for businesses and consumers across India, BharatPe said in a press release on Tuesday.

BharatPe announced that Ravindra Pandey, Nalin Negi and Sabyasachi Senapati have been appointed on the board of Trillion loans.

Trillion Loans will operate as an independent entity with its own team under the supervision of the board. It will



explore partnerships with other financial technology firms and other companies to enable credit across a diverse set of businesses and consumers.

BharatPe has also infused a substantial amount of investment into Trillion Loans to enable the non-bank lender to grow its loan book.

Trillion Loans is a fastgrowing NBFC that offers a range of secured and unsecured loans to SMEs, including small business loans as well as working capital loans. The company also offers a variety of products like automobile loans, gold loans and consumer loans.

"Acquiring a controlling stake in Trillion Loans is aligned to the BharatPe Group's larger purpose and will enable us to facilitate access to capital for a wider set of underserved and un-banked businesses as well as customers," Shashvat Nakrani, founder and chief operating officer, BharatPe, said.

Fino Payments Bank profit up 25%

Tuesday reported a 25% increase in its post-tax net profit for the March 2023 quarter at ₹22.08 crore. The company had posted a post-tax net profit of ₹17.62 crore in

the year-ago period. Total income increased to

FINO PAYMENTS BANK on ₹323.43 crore, up from ₹285.29 crore in the year-ago period, and ₹314.10 crore in the preceding December quarter. Operating expenses rose to ₹287 crore from ₹263 crore in the year-ago period, the payments bank said in a state-

FROM THE FRONT PAGE

AADHAAR-BASED TRANSACTIONS

Airtel Payments Bank unveils face authentication

FE BUREAU New Delhi, May 2

AIRTEL PAYMENTS BANK, the fintech arm of Bharti Airtel, on Tuesday said it has rolled out face authentication for Aadhar-enabled Payment System (AePS) at 500,000 banking points in collaboration with the National Payments Corporation of India (NPCI). Airtel Payments Bank is among the four banks that offer face

authentication for AePS, it said. Until now, transactions were being authenticated using the customer's Aadhaar number and fingerprint or Iris match in the UIDAI records. The new facility will enable customers to validate transactions by undertaking face authentication, along with the Aadhaar number, the company

said in a release. "Face authentication is an important addition to our existing bouquet of secure and simple banking solutions to drive financial and digital inclusion," said Ganesh Ananthanarayanan, chief operating officer at Airtel Payments Bank.

"We commend UIDAI for introducing face authentication as an additional mode for Aadhaar-based authentication. It's delightful to see Airtel Payment Bank implementing this feature for AePS transactions, which will enhance the reach of Aadhaar-based transactions," said Praveena Rai,

chief operating officer at NPCI. Currently, the face authentication feature is available for non-financial transactions such as balance inquiry and mini-statements. The bank will soon make it available for financial transactions for customers of other banks as well, Airtel Payments Bank said.

Customers can avail of the facility at banking points of Airtel Payments Bank, where banking correspondents will help them carry out transactions. Airtel Payments Bank has also partnered with the NPCI for testing digital payments through feature phones. The company is also testing interactive voice response (IVR), among other use cases, with the NPCI for digital payments in tier-II and tier-III cities.

Carlyle, Premji Invest eye stake in **TVS Credit**

M SRIRAM Mumbai, May 2

PRIVATE EQUITY FIRM Carlyle and Azim Premji's investment unit are in separate talks to invest about \$150 million in TVS Credit Services, an arm of TVS Motors, two sources told Reuters.

The winner of the race to bet on India's fast-growing shadow-banking sector could get a stake of 20%, one of the sources said. A valuation of about ₹5,000 crore (\$612 million) for TVS Credit is being discussed, both sources said.

TVS Credit, which mainly offers loans for two-wheel vehicles and used cars, supporting its parent's business, recently expanded into personal, consumer loans and pre-approved credit via credit cards for items such as mobile phones.

Carlyle engaged with the company a few months ago, but Premji Invest is now the front-runner to strike a deal, said one of the sources, both of whom sought anonymity as the details of the talks were private.

A decision is expected by the end of May, the source -REUTERS added.

Rally in bonds is likely over

THE RALLY SEEN in government bond prices in April is likely over and upcoming weekly debt supplies will prompt a reversal in demand in coming months, bankers said on Tuesday, reports **Reuters**. The benchmark yield

declined 20 bps last month, its biggest monthly fall since March 2020. The benchmark 7.26% 2033 bond vield was

at 7.12%, after briefly



touching 7.07% in April, its lowest level in a year. As the demandsupply dynamics will be less favourable, there could be some consolidation around the 7.10% levels. PSBs will continue to sell bonds to book profits.

10-year govt bond yield (%) 7.40 7.34 7.35 7.31 7.30 7.25 7.20 7.15 7.10 7.05 Mar 15, 2023 Mar 31 Apr 12 May 2, 2023

Fincare SFB files draft IPO papers with Sebi

FINCARE, A DIGITAL-FIRST SFB, has filed the draft red herring prospectus with Sebi for an IPO. It plans to raise funds through the issuance of equity share capital of face value ₹10 each, comprising a fresh issue aggregating up to ₹625 crore. **FE BUREAU**

Apollo Micro Systems to sub-divide share

APOLLO MICRO SYSTEMS, which provides technologybased solutions to infrastructure and transportation players, has fixed May 4 as the record date to split its shares in the ratio of 1:10.

Rupee falls 5 paise to 81.87 ahead of Fed meet outcome

THE RUPEE CONSOLIDATED in a narrow range and settled 5 paise lower at 81.87 against the dollar on Tuesday as investors preferred to stay on the sidelines ahead of the outcome of the meeting of the US Federal reserve.

6 clearing houses

lose ESMA clearance as deadline lapses

national regulators of French and German banks, Autorité des marchés financiers (AMF) and the Federal Financial Supervisory Authority (BaFIN), respectively, announced an additional 18 months till October 2024 for French and German banks to comply with ESMA's decision and terminate their membership of CCIL.

As a result, some European banks will continue to use the clearing and settlement services of CCIL as of now.

According to reports, the Reserve Bank of India and other regulators have been engaging with relevant stakeholders, including ESMA and the European Commission, to arrive at a mutually acceptable arrangement that recognises the territorial independence of the host regulator.

ESMA's norms mandate an



exchange of information between the European market regulator and competent authorities of third countries, including access to all information requested with regard to clearing houses. CCIL is supervised by the RBI, NSE IFSC Clearing Corporation under the GIFT City regulator International Financial Services Centres Authority; and the rest are regulated by the SEBI.

While all foreign branches in India operate as branches of parent organisations, they are headquartered abroad. Hence, they are bound by the norms of their respective home regulator.

The recognition of Indian clearing houses is important for these foreign banks as they run custodian businesses in India that handle secondary stock and bond market trades of foreign portfolio investors and local institutions like mutual funds.

They also conduct trades like currency forwards, where a bank hedges the currency risk of a client purchasing or selling dollars or any other foreign currency, and interest rate swaps where two entities exchange fixed interest payments through floating rate payment to cover interest rate risks.

Around 9,000 funds are registered as foreign portfolio investors in India and a third of them come from Europe.

In its latest Financial Stability Report, the RBI said it is exploring alternative arrangements and will take remedial steps in case of market disruptions.

red Office: 7th Floor, Popular House, Ashram Road Ahmedabad - 380 009 Work: 745, Kadi-Thor road, Kadi - 382 715 Dist.: Mehsana (North Gujarat) prateins.com, Web: www.nkin CIN: L91110GJ1987PLC009905, Ph.: +91-79-6630 9999

Extracts of Audited Standalone and Consolidated Financial Results for the guarter and year ended on 31st March, 2023 (Rs. In lacs)

| | Stand | Standalone | | lidated |
|---|-----------------------------|--------------------------|-----------------------------|--------------------------|
| Particulars | Quarter ended 31.03.2023 | Year ended 31.03.2023 | Quarter ended 31.03.2023 | Year ended 31.03.2023 |
| Total income from opertions (net) | 60.56 | 240.56 | 858.75 | 1,777.47 |
| Net Profit/(Loss) (before Extraordinary activities after tax) | (6.31) | (161.01) | 38.21 | (186.11) |
| Net Profit/(Loss) for the period after tax (after Extraordinary items)\ | (6.31) | (161.01) | 38.21 | (186.11) |
| Equity Share Capital | 600.99 | 600.99 | 600.99 | 600.99 |
| Earnings Per Share (before extraordinary items) of Rs.10/- each Basic: Diluted: | (0.10) | (2.68) | (0.64) | (3.10) |
| Earnings Per Share (after extraordinary items) of Rs.10/- each Basic: Diluted: | (0.10) | (2.68) | (0.64) | (3.10) |

Note:

Place: Ahmedabad

Date: 02/05/2023

1. The above is an extract of the detailed format of Audited Financial Results filed with the Stock Exchanges under Regulation 33 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015. The full formats of the Audited Quarterly Financial results are available on the Stock Exchange websites.

(URL: http://www.bseindia.com/corporates/ann.aspx?scrip=519494&dur=A&expandable=0)

For and on behalf of Board of Directors

Mr. Hasmukhbhai Kacharabhai Patel Din: 06587284 (Whole Time Director)

N K Industries Limited

continued from previous page.

refer to the Offer Document for the full text of the Disclaimer clause of the BSE on page 4 of the Offer Document.

General Risks: Investments in Units involve a degree of risk and investors should not invest any funds in the Offer unless they can afford to take the risk of losing their entire investment. For taking an investment decision, investors must rely on their own examination of the Nexus Select Trust and the Offer. Prospective Investors are advised to read "Risk Factors" on page 24 of the Offer Document before making an investment decision relating to the Offer. Each prospective investor is advised to consult its own advisors in respect of the consequences of an investment in the Units being issued pursuant to the Offer Document. The Offer Document has been prepared by the **BOOK RUNNING LEAD MANAGERS**

Manager solely for providing information in connection with the Offer. The Securities and Exchange Board of India ("SEBI") and the Stock Exchanges assume no responsibility for or guarantee the correctness or accuracy of any statements made, opinions expressed, or reports contained herein. Admission of the Units to be issued pursuant to the Offer for trading on the Stock Exchanges should not be taken as an indication of the merits of the Nexus Select Trust or of the Units. A copy of the Offer Document has been delivered to SEBI and the Stock Exchanges.

IIFL SECURITIES

BofA SECURITIES **BofA Securities India Limited** Ground Floor, "A" Wing One BKC, "G" Block Bandra Kurla Complex, Bandra (East) Mumbai 400 051, Maharashtra, India Tel: +91 22 6632 8000 E-mail: dg.nexus select trust ipo@bofa.com Investor grievance e-mail: dg india merchantbanking@bofa.com Website: www.ml-india.com Contact Person: Abhrajeet Banerjee

SEBI Registration No.: INM000011625

AXIS CAPITAL **Axis Capital Limited** Axis House, Level 1, C-2 Wadia International Centre, Pandurang Budhkar Marg, Worli, Mumbai 400 025. Maharashtra, India

Tel: +91 22 4325 2183 E-mail: nexusselecttrust.ipo@axiscap.in Investor grievance e-mail: complaints@axiscap.in Website: www.axiscapital.co.in Contact Person: Harish Patel SEBI Registration No.: INM000012029

Citigroup Global Markets India Private Limited 1202, 12" Floor, First International Finance Centre, G-Block, Bandra Kurla Complex, Bandra (East), Mumbai 400 098, Maharashtra, India Tel: +91 22 6175 9999 E-mail: nexusselecttrust.ipo@citi.com Investor grievance e-mail: investors.cgmib@citi.com Website:www.online.citibank.co.in/rhtm/citigroupgloba Iscreen1.htm Contact Person: Huzefa Bodabhaiwala

HSBC Securities and Capital Markets (India) Private Limited Tel: +91 22 6864 1289

52/60, Mahatama Gandhi Road, Fort, Mumbai 400 001, Maharashtra, India E-mail: nexusmallsipo@hsbc.co.in Investor Grievance ID: investorgrievance@hsbc.co.in Website: www.business.hsbc.co.in/en-gb/ in/generic/ipo-open-offer-and-buyback Contact Person: Vipin Jha/Rishi Tiwari

HSBC

SEBI Registration No.: INM000010353

IIFL Securities Limited 10th Floor, IIFL Centre, Kamala City, Senapati Bapat Marg, Lower Parel (West), Mumbai 400 013, Maharashtra, India Tel: +91 22 4646 4728 E-mail: nexus.reit@iificap.com Website: www.iiflcap.com Investor Grievance ID: ig.ib@iiflcap.com Contact Person: Harshvardhan Jain/ Pawan Kumar Jain SEBI Registration No.: INM000010940

JM Financial Limited 7" Floor, Cnergy, Appasaheb Marathe Marg, Prabhadevi, Mumbai 400 025, Maharashtra, India Tel: +91 22 6623 3000 E-mail: nexus.trust@jmfl.com Website: www.jmfl.com Investor Grievance ID: grievance.ibd@jmfl.com Contact Person: Prachee Dhuri

SEBI Registration No.: INM000010361

Charu Patki

A JM FINANCIAL

J.P.Morgan

J.P. Morgan India Private Limited J.P. Morgan Tower, Off. C.S.T. Road, Kalina, Bandra Kurla Complex, Bandra (East),

Santacruz (East), Mumbai 400 098 Maharashtra, India Tel: +91 22 6157 3000 Investor grievance e-mail: investorsmb.jpmipl@jpmorgan.com Website: www.jpmipl.com Contact Person: Nidhi Wangnoo/ Govind Khetan SEBI Registration No.: INM000002970

(a) kotak Kotak Mahindra Capital Company Limited 1" Floor, 27 BKC, Plot No. 27 G Block,

Investor grievance e-mail: kmccredressal@kotak.com Website: https://investmentbank.kotak.com Contact Person: Ganesh Rane SEBI Registration No.: INM000008704

Mumbai 400 051, Maharashtra, India

Tel: +91 22 4336 0000

Morgan Stanley

SEBI Registration No.: INM000010718

BOOK RUNNING LEAD MANAGERS

Morgan Stanley India Company Private Limited 18" Floor, Tower 2, One World Center Plot 841, Jupiter Textile Mill Compound, Senapati Bapat Marg, Lower Parel, Mumbai 400 013, Maharashtra, India Tel: +91 22 6118 1000

Investor grievance e-mail: investors_india@morganstanley.com Website: www.morganstanley.com Contact Person: Shreyas Goel SEBI Registration No.: INM000011203

OSBICAPS

202, Maker Tower "E", Cuffe Parade Mumbai 400 005, Maharashtra, India Tel: +91 22 2217 8300 E-mail: nexusselecttrust@sbicaps.com Investor Grievance ID: investor.relations@sbicaps.com Website: www.sbicaps.com Contact Person: Sambit Rath/Karan Savardekar

SEBI Registration Number: INM000003531

SBI Capital Markets Limited

REGISTRAR TO THE OFFER ▲ KFINTECH

KFin Technologies Limited Selenium, Tower B, Plot No. 31 and 32 Financial District, Nanakramguda, Serilingampally Hyderabad, Rangareddi 500 032 Telangana, India Tel: +91 40 6716 2222 E-mail: nexusselecttrust.ipo@kfintech.com Investor grievance e-mail: einward.ris@kfintech.com

Website: www.kfintech.com

Contact Person: M Murali Krishna

SEBI Registration No.: INR000000221

Embassy 247, Unit No. 501, B Wing, Lal Bahadur Shastri Marg, Vikhroli West, Mumbai 400 083 Maharashtra, India Tel: +91 22 6280 5000 Fax: NA E-mail: charu.patki@nexusmalls.com Website: www.nexusselecttrust.com Bidders can contact the Compliance Officer or the

COMPLIANCE OFFICER

Offer related problems such as non-receipt of Allotment Advice/ letter of Allotment, credit of Allotted Units in the respective beneficiary account and refund orders and non-receipt of funds by electronic mode. AVAILABILITY OF THE OFFER DOCUMENT: Investors are advised to refer to the Offer Document and the Risk Factors section on page 24 of the Offer Document, contained therein before applying in the Offer Document and the Risk Factors section on page 24 of the Offer Document, contained therein before applying in the Offer Document and the Risk Factors section on page 24 of th

Registrar to the Offer in case of any pre-Offer or post-

websites of the Book Running Lead Managers, i.e. BofA Securities India Limited, Axis Capital Limited, Morgan Stanley India

No. 12 April 19 April 1 Company Private Limited, and SBI Capital Markets Limited at www.ml-india.com, www.ml-india.com, www.ml-india.com, www.morganstanley.com and www.sbicaps.com, respectively. AVAILABILITY OF BID CUM APPLICATION FORMS: Bid-cum-Application Forms can be obtained from the Principal place of business of Nexus Select Trust, Tel: +91 22 6632 8000; Axis Capital Limited, Tel: +91 22 4325 2183; Citigroup Global Markets India

Private Limited, Tel: +91 22 6175 9999; HSBC Securities and Capital Markets (India) Private Limited, Tel: +91 22 6623 3000; J.P. Morgan India Private Limited, Tel: +91 22 6157 3000; Kotak Mahindra Capital Company Limited, Tel: +91 22 4336 0000;

Morgan Stanley India Company Private Limited, Tel: +91 22 6118 1000 and SBI Capital Markets Limited, Tel: +91 22 6218 5410 and India Securities Limited, Tel: +91 22 6136 3400, Kotak Securities Limited, Tel: +91 22 6218 5410 and India Securities Limited, Tel: +91 22 6136 3400, Kotak Securities Limited, Tel: +91 22 6218 5410 and India Securities Limited, Tel: +91 22 6136 3400, Kotak Securities Limited, Tel: +91 22 6218 5410 and India Securities Limited, Tel: +91 22 6136 3400, Kotak Securities Limited, Tel: +91 22 6136 3400, SBICAP Securities Limited, Tel: +91 22 6931 6204 and at the select locations of the Sub-syndicate Members, SCSBs, Registered Brokers, RTAs and CDPs participating in the Offer. Bid-cum-Application Forms will also be available on the websites of the Stock Exchanges and the Designated Branches of SCSBs, the list of which is available at websites of APPLICATIONS SUPPORTED BY BLOCKED AMOUNT (ASBA): Investors other than Anchor Investors have to apply through the ASBA process, please refer to the details given in the ASBA process, please refer to the details on the ASBA process, please refer to the details on the ASBA process. For details on the ASBA process, please refer to the details on the ASBA process. Offer Document. ASBA Forms can also be downloaded from the websites of the Stock Exchanges. ASBA form can be obtained from Members of the Syndicate, Registered Brokers from list provided on the websites of the BSE and the NSE at

http://www.bseindia.com/Markets/PublicIssues/brokercentres new.aspx?expandable=3 and http://www.nseindia.com/products/content/equities/ipos/ipo mem terminal.htm, respectively, RTAs and CDPs from the list provided on the websites of Stock Exchanges at http://www.bseindia.com/Static/Markets/PublicIssues/RtaDp.aspx?expandable=6 and https://www.nseindia.com/products-services/initial-public-offerings-asba-procedures, respectively. Sub-syndicate Members: Axis Securities Limited, Amrapali Capital & Finance Services Limited, Anand Rathi Share & Stock Brokers Limited, Anand Share Consultancy, ANS Pvt Limited, Anand Share Brokers Ltd, G Raj & Co. (Consultants) Limited, Anand Share & Stock Brokers Limited, Anand Share Brokers Ltd, G Raj & Co. (Consultants) Limited, Anand Share & Stock Brokers Limited, Anand Sha Globe Capital Markets Ltd, HDFC Securities Limited, ICICI Securities Limited, ICICI Securities Limited, Lakshmishree Investment & Securities Pvt Limited, LKP Securities Limited, LMP Securities Limited, Lakshmishree Investment & Securities Pvt Limited, LKP Securities Limited, Limited, Limited, Lakshmishree Investment & Securities Pvt Limited, LKP Securities Limited, Limited, Limited, Lakshmishree Investment & Securities Limited, Lakshmishree Investment & Securities Limited, Li Marwadi Shares & Finance, Motilal Oswal Financial Services Limited, Pravin Ratilal Share & Stock Brokers

Marwadi Shares & Finance, Motilal Oswal Financial Services Limited, Pravin Ratilal Share & Stock Brokers


Marwadi Shares & Finance, Motilal Oswal Financial Services Limited, Pravin Ratilal Share & Stock Brokers Limited, Religare Broking Ltd, RKSV Securities India Private Limited, RR Equity Brokers Pvt. Ltd, Sharekhan Limited, SMC Global Securities Ltd, Tanna Financial Services, Tradebulls Securities Limited and Yes Securities (India) Limited

Escrow Collection Bank, Public Offer Account Bank, Sponsor Bank and Refund Bank; Axis Bank Limited All capitalized terms used herein and not specifically defined shall have the same meaning as ascribed to them in the Offer Document.

On behalf of Nexus Select Trust

Sd/-Charu Patki Compliance Officer

Date: May 2, 2023 Nexus Select Trust, acting through its Manager, is proposing, subject to receipt of requisite approvals, market conditions and other considerations, to make an initial offer of its Units representing an undivided beneficial interest in Nexus Select Trust, and has filed the Offer Document with SEBI and the Stock Exchanges on April 28, 2023. The Offer Document is available on the website of SEBI at www.sebi.gov.in, BSE at www.bseindia.com, NSE at www.bseindia.com as well as on the websites of the Book Running Lead Managers i.e. BofA Securities and Capital Markets (India) Private Limited, IIFL Securities Limited, JM Financial Limited, J.P. Morgan India Private Limited, Kotak Mahindra Capital Company Limited, Morgan Stanley India Company Private Limited, and SBI Capital Markets Limited, Morgan Stanley India Company Private Limited, and SBI Capital Markets Limited, and-buyback, www.infl.com, www.jmfl.com, www.jmfl.com, www.jmfl.com, www.jmfl.com, https://investmentbank.kotak.com, www.morganstanley.com and www.sbicaps.com, respectively. Potential investment in the Units involves a degree of risk, and for details relating to the same, should refer to the section "Risk Factors" of the Offer Document. These materials are not for publication or distribution, directly or indirectly, in or into the United States. These materials are not an offer for the sale of the Units or other securities are not an offer for the sale of the Units or other securities are not an offer for the sale of the Units or other securities. sold within the United States, except pursuant to an exemption from registration. No public offering of the Units or other securities is being made in the United States.



Place: Mumbai



Adfactors 046 Ahmedabad

